



Bhakta Kavi Narsinh Mehta University

Govt. Polytechnic Campus, Bhakta Kavi Narsinh Mehta University Road, Khadiya,
Junagadh, Gujarat (India)-362 263 Ph.(0)0285-2681400 / Fax : 0285-2681503

Website : <http://www.bknmu.edu.in>

Email : cebknmu@gmail.com

પરીપત્ર

વિષય : આગામી ઓગષ્ટ-૨૦૨૧ માં યોજનાર એલએલ.બી. સેમ. ૨ ની પરીક્ષાના પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી શરૂ કરવા બાબત.

આથી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કાયદા વિદ્યાશાખાની તમામ કોલેજોના આચાર્યશ્રીઓ, સંસ્થાના વડાઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનોને જણાવવાનું કે ઓગષ્ટ-૨૦૨૧ માં યોજનાર એલએલ.બી. સેમ. ૨ ની પરીક્ષાના પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રીની તારીખ નીચે મુજબ રહેશે. નિયત સમય-મર્યાદામાં કોલેજ દ્વારા તેમના લોગીન મારફત એન્ટ્રી કરવાની રહેશે જેની સર્વે સંબંધીતોએ નોંધ લેવી.

કોર્સનું નામ	રેગ્યુલર ફી	લેઇટ ફી [રેગ્યુલર ફી + ૫૦૦]	દંડાત્મક ફી [રેગ્યુલર ફી + ૫૦૦ + ૧૫૦૦]
એલએલ.બી. સેમ. ૨	તા. ૨૪/૦૭/૨૦૨૧ થી તા. ૩૧/૦૭/૨૦૨૧	તા. ૦૧/૦૮/૨૦૨૧ થી તા. ૦૩/૦૮/૨૦૨૧	તા. ૦૪/૦૮/૨૦૨૧ થી તા. ૦૫/૦૮/૨૦૨૧

છેલ્લી તારીખ બાદ કરવામાં આવેલ સુધારો સોફ્ટવેર સ્વીકારશે નહીં જેની નોંધ લેવી તેમજ દંડાત્મક ફી ની તારીખ બાદ પણ જો કોઈ વિદ્યાર્થીના પરીક્ષા ફોર્મ ભરવાના બાકી હોય તો તેવા વિદ્યાર્થીના પરીક્ષા ફોર્મ યુનિવર્સિટી ખાતેથી ભરવાનાં રહેશે.

દંડાત્મક ફી સાથેની છેલ્લી તારીખ બાદ ચાલુ કામકાજના દિવસ ૧(એક)માં ફરજિયાત પણે ફી મેમો તેમજ ચેકલિસ્ટ પરીક્ષા વિભાગમાં જમા કરાવવાનો રહેશે. જેની ગંભીરતાથી નોંધ લેવી તથા પરીક્ષા ફોર્મ ફી “રજીસ્ટ્રાર, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ” ના નામના ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની રહેશે.

ખાસ નોંધ :

૧. દરેક વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મની સોફ્ટવેરમાં એન્ટ્રી કોલેજ દ્વારા કાળજીપૂર્વક કરવાની રહેશે.
૨. કોલેજ દ્વારા પરીક્ષા ફોર્મની એન્ટ્રી થયા બાદ ફરજિયાત વેરીફાય કરી લેવાનું રહેશે.
૩. રીપીટર વિદ્યાર્થીનાં વિષયમાં ફેરફાર કરી આપવામાં આવશે નહીં જે કોલેજ તેમજ વિદ્યાર્થીઓએ ધ્યાને લેવું.
૪. પરીક્ષાના આવેદનપત્ર કોલેજ પોતાની પાસે રેકોર્ડ માં સાચવીને રાખવાં જરૂર પડશે યુનિવર્સિટી દ્વારા મંગાવવામાં આવે તો રજૂ કરવાનાં રહેશે.
૫. COVID-19 અંગે સરકારશ્રી દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી (ફેસ કવર) તેમજ સામાજિક અંતર જાળવી ઉપરોક્ત કામગીરી કરવાની રહેશે.


પરીક્ષા નિયામક

ક્રમાંક - બીકેએનએમયુ/પરીક્ષા/૧૨૬૯/૨૦૨૧

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,

ખડિયા, જુનાગઢ-૩૬૨૨૬૩

તા. ૨૩/૦૭/૨૦૨૧

પ્રતિ,

યુનિવર્સિટી સંલગ્ન કાયદા વિદ્યાશાખાની તમામ કોલેજોના આચાર્યશ્રીઓ, સંસ્થાના વડાઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો તરફ...

નકલ સવિનય રવાના:-

(૧) માન.કુલપતિશ્રી/કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી

(૨) આઈ.ટી. સેલ (વેબસાઇટ પર પ્રસિધ્ધ થવા તેમજ યોગ્ય કાર્યવાહી અર્થે)